



JAP-16080001010200

Seat No. \_\_\_\_\_

**B. Com. (Sem. I) (CBCS) Examination**

**November - 2019**

**Principles of Micro Economics - I**

*(Old Course)*

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70

- સૂચના : (૧) જરૂર જણાય ત્યાં આલેખ દોરો.  
(૨) જમણી બાજુ દર્શાવેલ અંક ગુણ દર્શાવે છે.

૧ ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે શું ? ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર વર્ણવો. ૨૦

**અથવા**

૧ (અ) વટાવનો સિદ્ધાંત સમજાવો. ૧૦  
(બ) વૃદ્ધિનો ખ્યાલ સમજાવો. ૧૦

૨ માંગની મૂલ્યસાપેક્ષતા એટલે શું ? માંગની મૂલ્યસાપેક્ષતા માપવાની રીતો વિગતે સમજાવો. ૨૦

**અથવા**

૨ (અ) માંગની મૂલ્યસાપેક્ષતાનો પ્રકારો સમજાવો. ૧૦  
(બ) માંગની મૂલ્યસાપેક્ષતાને અસર કરતાં પરિબલો સમજાવો. ૧૦

૩ ઉત્પાદન વિધેય એટલે શું ? ઘટતાં મળતરનો નિયમ ઉદાહરણ તથા આલેખની મદદથી સમજાવો. ૧૫

**અથવા**

૩ વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત વિગતે સમજાવો. ૧૫

૪ ટૂંકાગાળામાં સરેરાશ અને સીમાંત ખર્ચના ખ્યાલો સમજાવી બંને વચ્ચેના આંતરસંબંધો આલેખની મદદથી સમજાવો. ૧૫

**અથવા**

૪ (અ) સમઉત્પાદન વક્રનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો. ૮  
(બ) લાંબાગાળામાં પેઢીના ખર્ચ અંગેનો આધુનિક સિદ્ધાંત સમજાવો. ૭

## ENGLISH VERSION

- Instructions:** (1) Draw diagram if necessary.  
(2) Figures to the right indicate marks.

1 What is business economics ? Explain the nature and scope of business economics. **20**

**OR**

1 (A) Explain the principle of discount. **10**

(B) Explain the incremental concept. **10**

2 What is price elasticity of demand ? Explain the methods of measuring the price elasticity of demand. **20**

**OR**

2 (A) Explain the kinds of price elasticity of demand. **10**

(B) Explain the factors affecting the price elasticity of demand. **10**

3 What is the meaning of production function ? Explain with illustration and diagram the law of diminishing return in the short run. **15**

**OR**

3 Explain in detail the marginal productivity theory of distribution. **15**

4 Explain and illustrate the interrelations between average cost and marginal cost in the short run with help of diagram. **15**

4 (A) Explain the meaning and characteristics of Iso-quant curve. **8**

(B) Explain the modern theory of production cost of firm in the long run. **7**